


સેન્ટ્રલ સ્ટોર્સ, અમદાવાદ  
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન



માહિતી પુસ્તકા

માહિતી ( મેળવવાના) આધિકાર આધિનિયમ-૨૦૦૫ અંતર્ગત

અધતન કર્યાતારીખ-૦૧/૦૭/૨૦૧૫

જુલાઈ -૨૦૧૫

---

-: સરનામું :-

સેન્ટ્રલ સ્ટોર્સ

જગાન્નાથ મંદિરની સામે,

જમાલપુર દરવાજા બણાર,

અમદાવાદ.


ટેલીફોન : (૦૭૯) ૨૪૩૮૦૭૩૦, ૨૪૩૮૬૭૧૩

## અનુક્રમણિકા

અ.નં.	વિગત	પાના નં.
૧	વિભાગનું વ્યવસ્થાતંત્ર, કાર્યો અને ફરજો	૩ થી ૩
૨	અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો	૪ થી ૪
૩	નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવાની કાર્યરીતિ	૪ થી ૬
૪	કાર્યો બજાવવા માટે નક્કી કરેલા ધોરણો	૬ થી ૬
૫	કાર્યો બજાવવા માટે ઉપયોગમાં લેવાતા નિયમો, વિનિયમો વિ	૬ થી ૮
૬	નિયંત્રણ હેઠળના દસ્તાવેજોના વર્ગોનું પત્રક	૮ થી ૮
૭	નીતિ અથવા તેના અમલીકરણના ઘડતર સંબંધમાં જનતાના સત્યો સાથે વિચારવિનિમયની ગોઠવણીની વિગતો	૮ થી ૮
૮	બોર્ડ વિ. બેઠકો લોકો માટે ખુલ્લી છે, બેઠકોની કાર્યનોંધ લોકોને મળવાપાત્ર છે કે કેમ	૮ થી ૮
૯	અધિકારીઓ અને કર્મચારીઓની માહિતી પુસ્તિકા	૮ થી ૯
૧૦	તેઓને મળતા માસિક વળતર	૮ થી ૧૦
૧૧	અંદાજ્યત્ર	૧૧ થી ૧૧
૧૨	આર્થિક સહાય કાર્યક્રમો	૧૧ થી ૧૧
૧૩	આપેલ છૂટછાટો વિ.	૧૧ થી ૧૧
૧૪	ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં ઉપલબ્ધ વિગતો	૧૨ થી ૧૨
૧૫	ગ્રંથાલય અને વાંચનાલયની સુવિધાઓની વિગતો	૧૨ થી ૧૨
૧૬	જાહેર માહિતી અધિકારીઓના નામ અને હોદાઓ	૧૨ થી ૧૨
૧૭	ઠરાવવામાં આવે તેવી બીજી માહિતી	૧૨ થી ૧૨

(૧) વિભાગનું વ્યવસ્થાતંત્ર, કાર્યો અને ફરજો :-

વ્યવસ્થાતંત્ર :-



અમદાવાદ ખુનિ.કોર્પોરેશનના વિવિધ ઝોનો તથા તેમાં આવતા વિવિધ ખાતાઓ માટે જરૂરી તમામ પ્રકારની વસ્તુઓ, માલસામાન ખરીદ કરવાની અને આ માલ ઈસ્યુ કરવાની મુખ્યત્વે કામગીરી સેન્ટ્રલ સ્ટોર્સની છે. જે અન્વયે વસ્તુના પ્રકાર મુજબ નીચે પ્રમાણે વિભાગો પાડવામાં આવેલ છે.

- (૧) જનરલ કન્ટી-જન્સી - સ્ટેશનરી, ફોર્મ્સ, ફન્ચિર, ડિટરજન્ટ આઈટમો,
- (૨) પ્રિન્ટીગ - છપાઈ કામ તથા પ્રિન્ટીગ તથા તેને લગતા પેપરના રોલ મંગાવવા
- (૩) ડ્રેસ - કર્મચારીઓ માટે યુનિફોર્મ, હોસ્પિટલને જરૂરી કાપડ, રેઇનકોટ
- (૪) હાઉસ - ઈજનેરી માલસામાન, પ્રિ-મોન્સુનને લગતો માલસામન, બગીચાને લગતા માલસામાન
- (૫) સી.પી.સી. - કાસ્ટ આર્યન્ ફીટીંગ્સ, ડક્ટાઈલ પાઈપો, શીશુ, શાશ, રોડ બોક્સ
- (૬) સ્ટીલ/સીમેન્ટ - મુખ્યત્વે સીમેન્ટ, જી.ટી.મશીનના સળીયા
- (૭) ટેન્ડર વિભાગ - ટેન્ડરો બહાર પાડીને માલસામાન મંગાવવાની કાર્યવાહી

## (૨) અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો:-

ઉપરના વિભાગો આવેલ માલસામાન જમા તથા ઈસ્યુ કરવાની કામગીરી કરે છે. આ ઉપરાંત ટેન્ડર બ્રાન્ચ જે-તે ખાતાની જરૂરીયાત મુજબ બજારમાંથી માલસામાન ખરીદવાની, તથા વાર્ષિક ટેન્ડરો બહાર પાડીને માલસામાન મંગાવવાની કાર્યવાહી કરે છે. એકાઉન્ટ બીલો બનાવવાની તથા તેના રેકર્ડ રાખવાની કામગીરી કરે છે. જેમાં ટેન્ડર કલાર્ક, કેશ કલાર્ક, વિગેરોનો સમાવેશ થાય છે. એસ્ટ્રાબ્લીશમેન્ટ બ્રાન્ચમાં બીલ કલાર્ક, ઈન્વર્ટ-આઉટવર્ક કલાર્ક તથા કન્ટીન્જન્સી કલાર્ક, જાંપા કલાર્ક, પટાવણ તથા સફાઈ કામદાર વિગેરેનો સમાવેશ થાય છે. તેની દેખરેખ માટે પરચેઝ હેડ કલાર્ક તેમજ આસી.સી.ટી. ઈજનેર ફરજ બજાવે છે. ટેકનીકલ બાબતો, ક્વોલીટી કન્ટ્રોલ તેમજ ઈસ્યુ કામગીરી માટે આસી.સી.ટી. ઈજનેર ફરજ બજાવે છે. ઉપરના તમામ સ્ટાફની દેખરેખ માટે સ્ટોર્સ સુપ્રિન્ટેન્નેન્ટ હોય છે.

## (૩) નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવાની કાર્યરીતી:-

### સરક્યુલર બહાર પાડી જરૂરીયાતની માહિતી મંગાવવાની પ્રક્રિયા

અમદાવાદ ખુનિ.કોર્પો.ના જુદા-જુદા ખાતાઓની તેઓની વાર્ષિક જરૂરીયાતો માટે ડે.ખુનિ.કમિશનરશી (એમ.એમ)ની સહીથી વર્ષ દરમ્યાન નીચે મુજબના સરક્યુલર કરવામાં આવે છે.

૧. જનરલ કન્ટીજન્સી તેમજ અન્ય આઈટમો માટેનો સરક્યુલર

૨. પ્રિ-મોન્સુનની આઈટમો માટેનો સરક્યુલર

૩. પાણીના કામ માટની જરૂરીયાત મુજબના ડી.આઈ પાઈપ, સી.આઈ સ્પેસીયલ્સ, શીશુ, શાશ તેમજ રોડ બોક્સ વિગેરે આઈટમોનો સરક્યુલર

૪. ફાયબર રેન ફોર્સર્ડ/મેનહોલ/ચેમ્બર ક્રેપીટ કવર્સ, ફેમ સાથે અથવા ફેમ વગર હેવી ડ્યુટી કે મીડીયમ ડ્યુટી તેમજ જરૂરી કાસ્ટ આયર્ન કવર્સ (મેનહોલ/ચેમ્બર ફેમ સાથે અથવા ફેમ વગર) વગેરે આઈટમો સરક્યુલર

૫. મ્યુનિસિપલ કોર્પોરેશનના નીતિ-નિયમ મુજબ પાત્રતા ધરાવતા વર્ગ-૩-૪ ના કર્મચારીઓને યુનિફોર્મ, ગરમ યુનિફોર્મ, બુટ-ચંપલ, રેઇનકોટ વગેરે આઈટમો માટેનો સરક્યુલર

૬. વિવિધ ખાતામાં પડી રહેલ બિન-વપરાશી આઈટમો (ભંગાર)ના નિકાલ માટેનો સરક્યુલર

ઉપરોક્ત સરક્યુલર દ્વારા સેન્ટ્રલ સ્ટોર્સ દ્વારા અ.મ્યુ.કોના જુદા જુદા ખાતાઓ પાસેથી તેઓની જરૂરીયાત મુજબના માલસામનની માહિતી મંગાવવામાં આવે છે. જુદા જુદા ખાતાઓની જરૂરીયાત તેઓના ડ.મ્યુનિ.કમિ.શ્રીની મંજુરીથી, સ્ટોર વેરીફીકેશન (નાણાં ખાતુ) બ્રાન્ચ દ્વારા ચકાસણી થયા પછી સેન્ટ્રલ સ્ટોર્સ ખાતે આવે છે. આવેલ માહિતીનું એકત્રીકરણ કરવામાં આવે છે.

### માહિતીનું એકત્રીકરણ કરવાની પ્રક્રિયા

આવેલ માહિતીને સેન્ટ્રલ સ્ટોર્સ ખાતામાં ઉપલબ્ધ સ્ટોક સાથે તેની સરખામણી કરવામાં આવે છે. ખુટા સ્ટોકની જરૂરીયાત માટે ખરીદીના હેતુથી રીકીવીઝીશન સ્લીપ સેન્ટ્રલ સ્ટોર્સના દરેક ઈસ્યુ વિભાગ દ્વારા ઈન્વેનટરી સીસ્ટમમાં એન્ટ્રી કરવામાં આવે છે. જેમાં છેલ્લા પાંચ વર્ષમાં ખરીદેલ જથ્થો, ભાવ, સપ્લાયરનું નામ, ઈસ્યુ, ક્લોજીંગ તથા ઓપનીંગ બેલેન્સ વગેરેનો ડેટા સ્ટોર્સ ઈન્વેનટરી સીસ્ટમમાંથી મેળવવામાં આવે છે. આ રીકીવીઝીશન સ્લીપ પરથી કેટલા માલની જરૂરિયાત છે તે મુજબ જે તે વિભાગ દ્વારા ખરીદ કરવાની થતી આઈટમોના સ્પેસીઝીકેશન તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ આ જથ્થાની ખરીદી માટેની કાર્યવાહી કરવાની સુધી.ઓફ સે.સ્ટોર્સની મંજુરી લેવામાં આવે છે. ત્યાર બાદ રેકીવીઝીશન સ્લીપ ટેન્ડર વિભાગને મોકલવામાં આવે છે.

### ટેન્ડરીંગની પ્રક્રિયા

આવેલ રેકીવીઝીશન સ્લીપના આધારે ટેન્ડર વિભાગ દ્વારા ટેન્ડર નોટીસ તૈયાર કરવામાં આવે છે જેમાં છેલ્લા ભાવ તેમજ બજારના પ્રવર્તમાન ભાવને આધારે અંદાજ તૈયાર કરવામાં આવે છે. જે અંદાજીત કિમતને આધારે ત ટકા ઈ.એમ.ડી. તથા ટેન્ડર ફી નક્કી કરવામાં આવે છે.

તૈયાર કરેલ ટેન્ડર નોટીસ છાપામાં જાહેરખબર આપવા તથા સામેલ આઈટમોની ખરીદી કરવાની મંજુરી મ્યુ.કમિ.શ્રીની લેવામાં આવે છે.

જે મુજબ રૂ.૫ લાખથી ઉપરના અંદાજીત રકમ માટેના ટેન્ડર ઓન-લાઈન ઈ-ટેન્ડર થી એન-કોડ સોલ્યુસન્સ મારફતે બહાર પાડવા માટે તેમજ રૂ.૫ લાખથી ઓછી અંદાજીત રકમના ટેન્ડરો અ.મ્યુ.કોની વેબસાઈટ પર મુકવા માટે મ્યુ.કોર્પોરના પબ્લિસીટી ખાતા દ્વારા સદર ટેન્ડર નોટીસની જાહેરખબર છાપામાં આપવામાં આવે છે.

જેમાં મંજુર થયેલ ટેન્ડરોનું ટેન્ડર ફોર્મ તૈયાર કરવામાં આવે છે જેમાં રેકવીજીશન સ્લીપના આધારે આઈટમનું નામ, સ્પેશીઝીકેશન, ખરીદીનો અંદાજ જથ્થો, તથા ખરીદી અંગેના શરતો તથા નિયમોનો ઉલ્લેખ સાથે વેબ સાઈટ ઉપર મુકવામા આવે છે. વેબ સાઈટ ઉપરથી જે તે વેપારી જાતે ટેન્ડર ફોર્મ ડાઉનલોડ કરી ટેન્ડર ઓફિસમાં જમા કરાવે છે.

આવેલ ટેન્ડરો ભ્યુનિ.કોર્પો.ના ટેન્ડર વિભાગમાં ટેન્ડર ઓફિસર ટેન્ડરરો તથા સેન્ટ્રલ સ્ટોર્સના સ્ટાફની હાજરીમાં ટેન્ડરો ખોલે છે. અને ટપાલથી સેન્ટ્રલ સ્ટોર્સમાં મોકલી આપે છે.

તૈયાર થયેલ ટેન્ડરકોપીઓમાં આસી.મેનેજરની સહીથી તેને કેશ વિભાગને પહોંચાડવામાં આવે છે.

કેશ વિભાગમાં જે તે વેપારીએ ભરેલ ઈ.એમ.ડી.તથા ટેન્ડર ફીના ડ્રાફ્ટ જમા લેવામા આવે છે. તેની નોંધ ટેન્ડર ઉપર કરવામાં આવે છેઅને આ ડ્રાફ્ટના નાણાં ભ્યુનિ.કોર્પો.ના નાણાં વિભાગમાં જમા કરાવવામાં આવે છે. ત્યાર બાદ નમુના તેમજ ટેન્ડરની શરતોનો અભ્યાસ કરી ક્વોલીફાઇડ થતા એલ-૧ ટેન્ડરર પાસેથી માલસામન ખરીદવા માટે યોગ્ય સત્તાની મંજુરી માંગવામા આવે છે.

#### (૪) કાર્યો બજાવવા માટે નક્કી કરેલા ધોરણો:-

ટેન્ડર મંજુરીના પાવર નીચે મુજબ છે.

૦ થી ૨,૦૦,૦૦૦ રૂપિયા	-	૩. ભ્યુ.કમિશનર
૨,૦૦,૦૦૧ થી ૫,૦૦,૦૦૦ રૂપિયા	-	૧૦. એસ.સી.કમિટી મારફતે ૩. ભ્યુ.કમિશનર
૫,૦૦,૦૦૧ થી ૧૫,૦૦,૦૦૦ રૂપિયા	-	ભ્યુનિસ્થિપલ કમિશનર
૧૫,૦૦,૦૦૦ થી ઉપર રૂપિયા	-	મટીરીયલ્સ મેનેજમેન્ટ એન્ડ પરચેઝ કમિટી મારફતે સ્ટેન્ડીંગ કમિટી

#### (૫) કાર્યો બજાવવા માટે ઉપયોગમાં લેવાતા નિયમો, વિનિયમો વિ.:-

(૧) બી.પી.એમ.સી. એક્ટ ના નીતિ-નિયમ મુજબ

(૨) સ્ટેન્ડીંગ કમિટીના વખતોવખતના ઠરાવ મુજબ

#### ખરીદીની પ્રક્રિયા

આમ, જે તે આઈટમના અંદાજીત ખર્ચ મુજબ યોગ્ય સત્તાની મંજુરી મેળવવામાં આવે છે. મંજુરી મળ્યેથી મંજુર થયેલ ટેન્ડરરને કરાર પેપર કરવા તથા ૫% ડીપોઝીટ ભરવા જાવક આપવામાં આવે છે. ત્યાર બાદ ટેન્ડરર ડીપોઝીટ ભરી કરાર પેપર કરે ત્યારે આ કરાર પેપરમાં અધિકારીઓ, ૩. ભ્યુ.કમિશનર તથા સ્ટેન્ડીંગ કમિટીના બે સભ્યોની સહીથી કરાર પેપર પૂર્ણ કર્યા બાદ આ ફાઈલ જે તે વિભાગમાં આપવામાં આવે છે. એક વાર ટેન્ડરર ને જે તે ટેન્ડરની ડીપોઝીટ તથા કરાર પેપર થઈ જાય ત્યાર બાદ અન્ય ટેન્ડરરો ની ભરેલી ઈ.એમ.ડી. સુપ્રિ.ઓફ સ્ટોર્સની મંજુરીથી પરત કરવામાં આવે છે.

આ વાર્ષિક ટેન્ડરોમાં યોગ્ય સત્તાની મંજુરી મળેથી શીર્ખુલ ઓર્ડર મુજબ જેમ-જેમ જરૂર પડે તેમ-તેમ વાર્ષિક રેઈટ કોન્ટ્રાક્ટથી માલ ટેન્ડરર પાસે મંગાવવામાં આવે છે. ટેન્ડરર દ્વારા આવેલ માલ ટેઈલી માલ રજીસ્ટરમાં તેમજ જે તે ખાતામાં ટેલી રજીસ્ટરમાં તેમજ સેન્ટ્રલ સ્ટોર્સ ઇનવેન્ટરી સીસ્ટમમાં જમા લેવામાં આવે છે.પૂરેપુરો માલ આવ્યા બાદ ટેકનીકલી માલ એપ્રુવ કર્યા પછી તેનું બીલ બનાવી પેમેન્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે.

વાર્ષિક ટેન્ડરમાં મંજુર થયેલ જથ્થા મુજબની ખરીદ પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી મંજુર થયેલ ટેન્ડરરે ભરેલ ડીપોઝિટની રકમ છુટી કરવામાં આવે છે.

### ઇસ્યુની પ્રક્રિયા

અ.મ્યુ.કોના વિવિધ વપરાશકર્તા ખાતાને આ માલની જરૂર પડ્યેથી માલ મેળવવા અંગેના ઈન્ડેન્ટમાં નિયત વિગતો,મંજુરી સાથે બજેટ જોગવાઈ બાદ માલ મેળવવા રજુ થયેથી માલસામાન ઈસ્યુ કરવામાં આવે છે. જે તે ખાતાને કોમ્પ્યુટર સ્લીપ (ગેટપાસ)થી માલસામાન ઈસ્યુ કરવામાં આવે છે.પરંતુ અનિવાર્ય સંજોગોમાં કોમ્પ્યુટરાઈઝડ સ્લીપ(ગેટપાસ) આપવી શક્ય ના હોય તો કાચી ચિહ્નિથી માલ ઈસ્યુ કરવામાં આવે છે,અને ત્યાર બાદ જ્યારે શક્ય બને ત્યારે કોમ્પ્યુટરાઈઝડ સ્લીપ(ગેટપાસ) બનાવવામાં આવે છે.

દરેક વિભાગમાં આવેલ માલસામાન જમા તથા ઇસ્યુની નોંધ ટેલી રજીસ્ટરમાં તેમજ સ્ટોર્સ ઇન્વેન્ટરીમાં કરવામાં આવે છે.અને તેને લગતા તમામ રેકર્ડ, ફાઈલો,વિગેરે રાખવામાં આવે છે.અને તેને ઈન્ડેન્ટ સાથે,એબસ્ટ્રેક્ટ તૈયાર કરી તેનું બીલ બનાવવા એકાઉન્ટ ખાતે મોકલવામાં આવે છે.અને એકાઉન્ટ ખાતુ તેનું બીલ બનાવી જમા ખર્ચી કરાવે છે.

જુદી જુદી આઈટમોનો ઉપલબ્ધ સ્ટોક ઓનલાઈન ઈન્ટ્રાલીક મારફત નિહાળી શકાય તેવી વ્યવસ્થા સે.સ્ટોર ઈન્વેન્ટરી સીસ્ટમ મારફતે કોમ્પ્યુટર પ્રોગ્રામીં ગોડવેલ છે.

વર્ષ દરમ્યાન જે તે માલનું બીલ બન્યા બાદ રૂ. ૧૦૦૦/- થી રૂ.૫,૦૦,૦૦૦/- સુધીની ફાઈલનું નિયમ ૭૩ ડી મુજબ સ્ટેન્ડીંગ કમિટીને જાણ કરવામાં આવે છે.

### ક્વોટેશન/બજાર પરચેઝની પ્રક્રિયા

કોઈ સામાનની ખરીદી તાકિદે કરવાની હોય તો તે.મ્યનિ.કમિ.શીની વહીવટી મંજુરી મેળવી ક્વોટેશન મંગાવવામાં આવે છે.

આવેલ તમામ ક્વોટેશન સુપ્રિ.ઓફ સેન્ટ્રલ સ્ટોર્સની રૂબરૂમાં ખોલવામાં આવે છે અને તેની નીચે મુજબ સક્ષમ સત્તાની મંજુરી માંગવામાં આવે છે.

#### ક્વોટેશનની રકમ રૂ.

રૂ.૦ થી ૧,૨૫,૦૦૦/-

રૂ. ૧,૨૫,૦૦૧ થી ૩,૦૦,૦૦૦/-

રૂ.૩,૦૦,૦૦૦ થી વધુ

#### સત્તા

તે.મ્યનિ.કમિશ્રર

મ્યનિ.કમિશનર

મટીરીયલ્સ મેનેજમેન્ટ એન્ડ પરચેઝ કમિટી  
મારફતે સ્ટેન્ડીંગ કમિટી

બાકીની પ્રોસીજર ટેન્ડર મુજબ કરવામાં આવે છે. પરંતુ જો બજારપરચેઝથી ક્વોટેશન દ્વારા ખરીદી કરવામાં આવેલ હોય તો બી.પી.એમ.સી. એક્ટ ચેપ્ટર ૫ ના રૂલ્સ ૨ (૨) મુજબ મંજુરી મેળવવામાં આવેલ હોય તો કરારપેપર કરવામાંથી તથા સીક્યોરીટી ડિપોઝિટ ભરવામાંથી મુક્તિ આપવામાં આવે છે.

### ઈન્કવાયરી/અપકામની પ્રક્રિયા

સેન્ટ્રલ સ્ટોર્સમાં સ્ટેશનરી છપાવવા અંગે પ્રિન્ટીગ વિભાગ દ્વારા નીચે મુજબ કાર્યવાહી કરી પ્રિન્ટીગ કામ કરી આપવામાં આવે છે. જાણકાર અને અનુભવી પ્રિન્ટરો પાસે રૂ. ૧૫,૦૦૦ ડિપોઝિટ જમા લઈને તેઓને ઈન્કવાયરી ભરવા દેવામાં આવે છે. જે તે ખાતાની સ્ટેશનરી છપાવવાની હોય તે ખાતા દ્વારા સેન્ટ્રલ સ્ટોર્સ ખાતેથી સ્ટેશનરી મેળવવાની જે તે સક્ષમસત્તાની મંજુરી તથા બજેટહેડ અને ઈન્ટેન્ટ ભરીને ગ્રાન્ટ નમુના સાથે સેન્ટ્રલ સ્ટોર્સના જાંપા કલાર્કને પહોંચાડવામાં આવે છે. જાંપા કલાર્ક દ્વારા ઈન્ટેન્ટ રજીસ્ટરમાં નોંધ કરી પ્રિન્ટીગ વિભાગને મોકલવામાં આવે છે. પ્રિન્ટીગ વિભાગ દ્વારા કાગળનો જરૂરી જથ્થો જોઈ ચકાસી સ્ટોક હોય તો કાગળ વગર અને જો સ્ટોક પુરતો ન હોય તો કાગળ સાથે છપાવવા અંગે ઈન્કવાયરી તૈયાર કરવામાં આવે છે. જેમાં આસી. મેનેજરની મંજુરી મેળવવામાં આવે છે. જેની રજીસ્ટરમાં નોંધ કરી નંબર આપવામાં આવે છે. આ ઈન્કવાયરીઓ દર સોમવારે અને ગુરુવારે પ્રિન્ટીગ ખાતાના નોટીસ બૉર્ડ ઉપર મુકવામાં આવે છે. પ્રિન્ટર દ્વારા ઈન્કવાયરી જોઈ બંધ કવરમાં ભાવ ભરી ટેન્ડર બોક્સમાં નાખવામાં આવે છે. સોમવારની ગુરુવારે તથા ગુરુવારની સોમવારે સાંજે ૪ વાગ્યા પછી આવેલ ઈન્કવાયરીઓ આસી. સી.ટી. ઈજનેરની રૂબરૂમાં ખોલવામાં આવે છે. જેનો કંપ્યેરેટીવ સ્ટેટમેન્ટ તૈયાર કરી નીચે મુજબ સક્ષમસત્તાની મંજુરી માંગવામાં આવે છે.

૦ થી ૧૦૦૦/-	રૂપિયા -	આસી. મેનેજર
૧૦૦૧ થી ૨૫૦૦/-	રૂપિયા -	સુપ્રિ. ઓફ સેન્ટ્રલ સ્ટોર્સ
૨૫૦૧ થી ૨૫,૦૦૦/-	રૂપિયા -	ડે.ચ્યુ. કમિશનર
૨૫,૦૦૧ થી ૫૦,૦૦૦/-	રૂપિયા -	ચ્યુનિસ્સિપલ કમિશનર
૫૦,૦૦૧ થી ૨,૦૦,૦૦૦/-	રૂપિયા	મટીરીયલ મેનેજમેન્ટ એન્ડ પરચેઝ કમિટી
૨,૦૦,૦૦૦ થી ઉપર	રૂપિયા -	સ્ટેન્ડીંગ કમિટી

મંજુરી તથા બીલ અંગેની કાર્યવાહી ટેન્ડર તથા ક્વોટેશનની કાર્યવાહી મુજબ કરવામાં આવે છે. રૂ. ૫૦૦/- ની મર્યાદામાં રોકડથી બીલ ઉપર સુપ્રિ. ઓફ સેન્ટ્રલ સ્ટોર્સની મંજુરીથી ઈમ્પ્રેશકેશમાં ખરીદી કરી શકાય છે.

### (૬) નિયંત્રણ હેઠળના દસ્તાવેજોના વર્ગોનું પત્રક:-

દરેક વિભાગમાં આવેલ માલસામાન જમા તથા ઈસયુની નોંધ લેજરમાં તેમજ સ્ટોર ઈન્વેન્ટરી સીસ્ટમમાં કરવામાં આવે છે. અને તેને લગતા તમામ રેકર્ડ, ફાઇલો વિગેરે રાખવામાં આવે છે.

(૭) નીતિ અથવા તેના અમલીકરણના ઘડતર સંબંધમાં જનતાના સભ્યો સાથે વિચારવિનિમયની ગોઈવણીની વિગતો:-

આ કચેરી દ્વારા કોઈ નીતિ ઘડતર કરવામાં આવતા નથી. જેથી નીતિના અમલ સંબંધી પ્રજાના પ્રતિનિધિઓ સાથે કોઈ સલાહ પરામર્શ કરવાની રહેતી નથી. અમદાવાદ ખુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિયુક્ત કરવામાં આવેલ મટીરીયલ્સ મેનેજમેન્ટ એન્ડ પરચેઝ કમિટી તથા સ્ટેન્ડીંગ કમિટીમાં એજન્ડા રજૂ કરી સર્વાનુમતે નિર્ણય લેવામાં આવે છે. જેથી જનતાના સભ્યો સાથે સલાહ પરામર્શ કરવાનો રહેતો ન હોવાથી તેમના પ્રતિનિધિત્વ માટે કોઈ વ્યવસ્થા કરવાની રહેતી નથી.

- (૮) બોર્ડવિ. બેઠકો લોકો માટે ખુલ્લી છે, બેઠકોની કાર્યનોંધ લોકોને મળવાપાત્ર છે કે કેમ? આ વિભાગને લાગુ પડતું નથી.

- (૯) અધિકારીઓ અને કર્મચારીઓની માહિતી પુસ્તિકા

- (૧૦) તેઓને મળતા માસિક વળતર

સેન્ટ્રલ સ્ટોર્સ સ્ટાફની માહિતી પુસ્તિકા અને તેઓને મળતા માસિક વળતર નીચે મુજબ છે.

નં.	નામ	હોદ્દો	પગારગ્રેડ
૧	મનીષ કે.ન્નિદ્રી	સુપ્રિ. ઓફ સેન્ટ્રલ સ્ટોર્સ (ઇન્દ્રાજી)	૧૫૬૦૦-૩૬૦૦૦
૨	પંકજભાઈ પટેલ	આસી.સી.ઈ	૮૩૦૦-૩૪૮૦૦
૩	દિપક નાયક	આસી.મેનેજર	૧૫૬૦૦-૩૬૦૦૦
૪	વિજયકુમાર.એલ.પટેલ	સ્ટેનોગ્રાફર	૮૩૦૦-૩૪૮૦૦
૫	રામસીગભાઈ વી.શૈલોત	દેડ.કલાર્ક	૮૩૦૦-૩૪૮૦૦
૬	હરદેવસિંહઅફ.વાધેલા	સીની.કલાર્ક	૮૩૦૦-૩૪૮૦૦
૭	અમિબેન પી.રાવલ	સીની.કલાર્ક	૮૩૦૦-૩૪૮૦૦
૮	ગાગબેન એમ.મીશા	સીની.કલાર્ક	૮૩૦૦-૩૪૮૦૦
૯	ઉશીરભાઈ શાહ	સીની.કલાર્ક	૮૩૦૦-૩૪૮૦૦
૧૦	અવનીબેન ભંડ	સીની.કલાર્ક	૮૩૦૦-૩૪૮૦૦
૧૧	વાધેલા મહેન્દ્રસિંહ	સીની.કલાર્ક	૮૩૦૦-૩૪૮૦૦
૧૨	રાજેશ સોની	સીની.કલાર્ક	૮૩૦૦-૩૪૮૦૦
૧૩	પરસોતમ પ્રજાપતિ	જુ.કલાર્ક	૮૩૦૦-૩૪૮૦૦
૧૪	વિનુસિંહ બી.સોલંકી	જુ.કલાર્ક	૫૨૦૦-૨૦૨૦૦
૧૫	હરેશભાઈ એમ.પરમાર	જુ.કલાર્ક	૫૨૦૦-૨૦૨૦૦
૧૬	રાખીબેન એમ.શાહ	જુ.કલાર્ક	૫૨૦૦-૨૦૨૦૦
૧૭	હીતેશ આર.ગઢવી	જુ.કલાર્ક	૫૨૦૦-૨૦૨૦૦
૧૮	કાંતાબેન એમ.દેસાઈ	જુ.કલાર્ક	૫૨૦૦-૨૦૨૦૦
૧૯	નિર્મલસિંહ ડી.ચાવડા	જુ.કલાર્ક	૫૨૦૦-૨૦૨૦૦

૨૦	પ્રવિષા ડી.સોલંકી	જુ.કલાર્ક	૫૨૦૦-૨૦૨૦૦
૨૧	કેતનભાઈ ત્રિવેણી	જુ.કલાર્ક	૫૨૦૦-૨૦૨૦૦
૨૨	જાલમસિંહ રાજપુત	જુ.કલાર્ક	૫૨૦૦-૨૦૨૦૦
૨૩	બીનાકુમારી એસ. ભવુ	જુ.કલાર્ક	૫૨૦૦-૨૦૨૦૦
૨૪	બિપીન સી. ઠાકોર	જુ.કલાર્ક	૫૨૦૦-૨૦૨૦૦
૨૫	મયુરીકા જોથી	જુ.કલાર્ક	૫૨૦૦-૨૦૨૦૦
૨૬	યુસુફભાઈ શેખ	જુ.કલાર્ક	૫૨૦૦-૨૦૨૦૦
૨૭	પટેલ રમેશકુમાર	જુ.કલાર્ક	૫૨૦૦-૨૦૨૦૦
૨૮	મેહુલકુમાર સુથાર	જુ.કલાર્ક	ફીક્સડ્રા. ૭૨૦૦
૨૯	ભગોરા શૈલેષ	જુ.કલાર્ક	ફીક્સડ્રા. ૭૨૦૦
૩૦	મહીડા બહાદુરસીહં	જુ.કલાર્ક	ફીક્સડ્રા. ૭૨૦૦
૩૧	ગોર જીનેશ	જુ.કલાર્ક	૫૨૦૦-૨૦૨૦૦
૩૨	હસમુખ ચૌહાણ	જુ.કલાર્ક	૫૨૦૦-૨૦૨૦૦
૩૩	કિંજલબેન કાપડીયા	ટેક.સુપરવાઈઝર	૫૨૦૦-૨૦૨૦૦
૩૪	નરેશભાઈ સી. મેસરીયા	સુપરવાઈઝર	૫૨૦૦-૨૦૨૦૦
૩૫	ગૌતમભાઈ કે.પરમાર	સુપરવાઈઝર	૫૨૦૦-૨૦૨૦૦
૩૬	યજોશભાઈ એસ.પાઠક	સુપરવાઈઝર	૫૨૦૦-૨૦૨૦૦
૩૭	રતિલાલ બી.સોલંકી	સુપરવાઈઝર	૫૨૦૦-૨૦૨૦૦
૩૮	ગંગાબેન એચ.જાદવ	મજૂર	ફીક્સડ્રા. ૬૩૬૦
૩૯	નારેબાનું એસ.પઠાણ	મજૂર	૪૪૪૦-૭૪૪૦
૪૦	પ્રફુલ કે.ભાવસાર	મજૂર	૪૪૪૦-૭૪૪૦
૪૧	ફીરોજ વાઈ.પઠાણ	મજૂર	૪૪૪૦-૭૪૪૦
૪૨	મકસુદ એમ.સૈયદ	મજૂર	૪૪૪૦-૭૪૪૦
૪૩	દીપક બી. ચૌહાણ	મજૂર	ફીક્સડ્રા. ૫૮૪૦
૪૪	જાયેદબાનું એમ.શેખ	પટાવાળા	૪૪૪૦-૭૪૪૦
૪૫	મારીયાબેન જે.કિશન	પટાવાળા	૪૪૪૦-૭૪૪૦
૪૬	બાલાબેન આર.હાવલીયા	સ્વીપર	૪૪૪૦-૭૪૪૦
૪૭	શૌકતહુસેન એચ. કુરેશી	વોચમેન	૫૨૦૦-૨૦૨૦૦
૪૮	અભુલ રાઝક શેખ	વોચમેન	૫૨૦૦-૨૦૨૦૦
૪૯	અનુપસિંહ આર.ચૌહાણ	વોચમેન	૫૨૦૦-૨૦૨૦૦
૫૦	શાહિદઅલી સૈયદ	વોચમેન	ફીક્સડ્રા. ૬૪૪૦
૫૧	અંકિત વી.મારુ	વોચમેન	ફીક્સડ્રા. ૬૪૪૦

(૧૧) અંદાજપત્ર:-

સને ૨૦૧૫-૧૬ ના બજેટમાં સેન્ટ્રલ સ્ટોર્સની અંદાજેલ આવક  
સેન્ટ્રલ સ્ટોર્સ ડિપાર્ટમેન્ટ-કમ્પ્યુટર કોડ-૧૫૧

કમ્પ્યુટર કોડ	બજેટ હેડ	અંદાજેલ આવક (રૂ. લાખમાં)
૨૩૨૦૧	સ્કેપ વેચાણની આવક	૨૦.૦૦
૨૩૨૦૨	પુસ્તક-ઘોપાનીયા વેચાણની આવક	૦.૩૦
૨૩૨૦૮	ટેન્ડર ફોર્મના વેચાણની આવક	૬.૦૦
૨૩૩૦૪	વેપારી પાસેથી મળેલ દંડની આવક	૨૫.૦૦
૨૩૩૦૮	જપ્ટ કરેલ ડિપોઝિટની આવક	૧.૦૦
૨૩૩૮૮	અન્ય પરચુરણ આવક	૦.૧૦
૧૫૧	સેન્ટ્રલ સ્ટોર્સનું કુલ	૫૨.૪૦

સને ૨૦૧૫-૧૬ ના બજેટમાં સેન્ટ્રલ સ્ટોર્સની અંદાજેલ ખર્ચ  
સેન્ટ્રલ સ્ટોર્સ ડિપાર્ટમેન્ટ-કમ્પ્યુટર કોડ-૧૫૧

કમ્પ્યુટર કોડ	બજેટ હેડ	અંદાજેલ ખર્ચ (રૂ. લાખમાં)
૩૦૧૮૮	પગાર ખર્ચ	૧૮૪.૬૨
૩૦૪૦૧	યુનીફોર્મ	૦.૩૦
૩૪૧૦૧	ટેલીફોન તથા ટ્રંકકોલ (ઓફિસ)	૦.૬૦
૩૪૧૦૨	પોસ્ટેજ તથા ટેલીગ્રામ	૦.૩૦
૩૪૪૦૧	સ્ટેશનરી	૩.૦૦
૩૪૪૦૪	પ્રિન્ટીંગ	૦.૭૫
૩૪૮૦૮	પુસ્તકો અખભારો સામાયીકો રમકડા	૦.૦૫
૩૪૮૮૮	અન્ય ખર્ચ	૭.૦૦
૩૮૨૨૪	સ્ટોર્સ ઓફિસના મકાનો	૪૦.૦૦
૩૮૦૦૪	પંખા તથા લાઈટ ફીટીંગ્સ	૩.૦૦
૧૫૧	સેન્ટ્રલ સ્ટોર્સનું કુલ	૨૩૮.૬૨

(૧૨) આર્થિક સહાય કાર્યક્રમો:-

આ વિભાગને લાગુ પડતુ નથી.

(૧૩) આપેલ છૂટથાટો વિ.:-

આ વિભાગને લાગુ પડતુ નથી.

**(૧૪) ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં ઉપલબ્ધ વિગતો:-**

અમદાવાદ ખુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ [www.egovamc.com](http://www.egovamc.com) ઉપર સેન્ટ્રલ સ્ટોર્સની માહિતી ઉપલબ્ધ છે. વેબ સાઇટમાં સમયાંતરે માહિતી અપડેટ કરવામાં આવે છે.

**(૧૫) ગ્રંથાલય અને વાંચનાલયની સુવિધાઓની વિગતો:-**

આ વિભાગને લાગુ પડતુ નથી.

**(૧૬) જાહેર માહિતી અધિકારી તથા એપેલેટ અધિકારીના નામો, હોદાઓ:-**

સેન્ટ્રલ સ્ટોર્સના જાહેર માહિતી અધિકારીઓના સંપર્કની વિગત

અ.નં.	નામ	હોદ્દો	ઓફિસ ટે.નં.	મો.નંબર
૧	મનિષભાઈ ત્રિવેદી	સુપ્રિ. ઓફ સેન્ટ્રલ સ્ટોર્સ (ઇન્ચાઈ) (અપીલ અધિકારી)	૨૫૩૮૬૭૧૩	૯૮૨૭૦૩૮૬૮૮
૨	પંકજ પટેલ	આસી.સી.ટી.ઇજનેર ( માહિતી અધિકારી)	૨૫૩૮૦૭૩૦	૯૮૨૭૦૩૮૭૧૭

**(૧૭) દરાવવામાં આવે તેવી બીજી માહિતી:-**

આ વિભાગને લાગુ પડતુ નથી.

